WWW.FINANCIALEXPRESS.COM FINANCIAL EXPRESS

17



UNIFIED PAYMENTS INTERFACE

UPI now available in ASBA for retail individual investors applying through Registered Brokers, DPs, & RTAs. Applicants to ensure PAN is updated in Bank Account being blocked by ASBA Bank. List of Banks supporting UPI is also available on SEBI at www.sebi.gov.in

For details on the ASBA and UPI process, please refer to the details given in ASBA form and abridged prospectus and also please refer to the section "Issue Procedure" beginning on page 164 of the Prospectus. The process is also available on the website of Stock Exchance and in the General Information Document. ASBA forms can be downloaded from the website of BSE and can be obtained from the list of banks that is displayed on the website of SEBI at www.sebi.gov.in.

The Application Forms which do not have the details of the Applicant's depository account including DP ID, PAN, UPI ID (in case of RIBs be traded after listing.

using the UPI mechanism) and Beneficiary Account Number shall be treated as incomplete and rejected. In case DP ID, Client ID and General RISKS: Investment in equity and equity related securities involve a degree of risk and investors should not invest any funds PAN mentioned in the Application Form and entered into the electronic system of the stock exchange, do not match with the DP ID, in this offer unless they can afford to take the risk of losing their investment. Investors are advised to read the risk factors carefully Client ID and PAN available in the depository database, the application is liable to be rejected. Applicants will not have the option of before taking an investment decision in this offering. For taking an investment decision, investors must rely on their own examination of getting allotment of the Equity Shares in physical form. The Equity Shares on allotment shall be traded only in the dematerialised the issuer and the offer including the risks involved. The securities have not been recommended or approved by the Securities and segment of the Stock Exchange Exchange Board of India (SEBI) nor does SEBI guarantee the accuracy or adequacy of this document. Specific attention of investors is

CONTENTS OF THE MEMORANDUM OF THE COMPANY AS REGARDS TO ITS OBJECTS: For information on the main objects of invited to the statement of "Risk factors" beginning on page no. 17 of the Prospectus. the Company, please see "Our History and Certain Corporate Matters" on page 97 of the Prospectus and Clause III of the Memorandum of Association of the Company. The Memorandum of Association of the Company is a material document for inspection ISSUEP'S ABSOL UTE RESPONSIBILITY. The issuer having made all reasonable inquirings accents report in relation to the Issue. For further details, please see "Material Contracts and Documents for Inspection" on page 193 of the

AMOUNT OF SHARE CAPITAL OF THE COMPANY AND CAPITAL STRUCTURE: The authorised share capital of the Company is ₹ 1550.00 Lakhs divided into 1,55,00,000 Equity Shares of ₹ 10 each. The issued, subscribed and paid-up Equity share capital of the Company is ₹ 1107.75 Lakhs divided into 1,10,77,550 Equity Shares of ₹ 10 each. For details of the capital structure, see "Capital Structure" beginning on page 39 of the Prospectus

SHARES SUBSCRIBED BY THEM: Given below are the names of the signatories of the Memorandum of Association of the Company and the number of Equity Shares subscribed for by them at the timeof signing of the Memorandum of Association. Equity share of face value of ₹ 10/- each were allotted to Faizal Bavaraparambil Abdul Khader - 13,50,000 equity shares; Bavaraparambil Abdulkadher DISCLAIMER CLAUSE OF SEBI: Since the Issue is being made in terms of Chapter IX of the SEBI (ICDR) Regulations, 2018, the Hydrose - 11,81,250 equity shares; Sruthi Muhammed Ali - 11,81,250 equity shares; Arakkal Ayyoob Soumya - 11,81,250 equity Draft Prospectus was furnished to SEBI in soft copy. In terms of the SEBI Regulations, the SEBI shall not issue any observation on the shares; Pathukunju Parayankudy Abubacker - 11,81,250 equity shares; Bavaraparambil Ayyoob Abdul Khader - 11,81,250 equity Offer Document. Hence, there is no such specific disclaimer clause of SEBI. However, investors may refer to the entire Disclaimer shares and Anaz Abdul Khader Bavaraparambil - 11,81,250 equity shares.

ISSUER'S ABSOLUTE RESPONSIBILITY: The issuer having made all reasonable inquiries, accepts responsibility for and confirms that this offer document contains all information with regard to the issuer and the issue which is material in the context of the Issue, that the information contained in the offer document is true and correct in all material aspectsand is not misleading in any material respect document as a whole or any of such information or the expression of any such opinions or intentions misleading in any material respect. LISTING: The Equity Shares of our company issued through this Prospectus are proposed to be listed on the SME Platform of BSE

NAMES OF THE SIGNATORIES TO THE MEMORANDUM OF ASSOCIATION OF THE COMPANY AND THE NUMBER OF EQUITY Limited. In terms of the Chapter IX of the SEBI ICDR Regulations, as amended from time to time, our company has received "inprincipal" approval letter dated January 17, 2022 from BSE for using its name in this offer document for listing of our shares on the SME Platform of BSE Limited. For the purposes of the issue, the Designated Stock Exchange will be BSE Limited ("BSE").

Clause of SEBI beginning on page 149 of the Prospectus.

LIABILITY OF THE MEMBERS: Liability of members of Company is Limited.

DISCLAIMER CLAUSE OF THE EXCHANGE (BSE LIMITED): It is to be distinctly understood that the permission given by BSE RISK IN RELATION TO THE FIRST ISSUE: This being the first issue of the issuer, there has been no formal market for the securities of Limited (BSE) should not in any way be deemed or construed that the contents of the Prospectus or the price at which the equity shares the issuer. The face value of the equity shares is ₹ 10⁷- each and the issue price is at par of face value of the equity share. The issue are offered has been cleared, solicited or approved by BSE, nor does it certify the correctness, accuracy or completeness of any of the price should not be taken to be indicative of the market price of the equity shares after the equity shares are listed. No assurance can be contents of the Prospectus. The investors are advised to refer to page 152 of the Prospectus for the full text of the Disclaimer Clause given regarding an active or sustained trading in the equity shares of our company or regarding the price at which the equity shares will pertaining to BSE".

LEAD MANAGER TO THE ISSUE	REGISTRAR TO THE ISSUE	COMPANY SECRETARY AND COMPLIANCE OFFICER
FINSHORE Creating Enterprise Managing Values FINSHORE MANAGEMENT SERVICES LIMITED Anandlok", Block-A, 2 rd Floor, Room No. 207, 227 A.J.C Bose Road, Kolkata-700020, West Bengal Telephone: 033 – 22895101: Email: ramakrishna@finshoregroup.com	CAMEO CAMEO CAMEO CORPORATE SERVICES LIMITED "Subramanian Building", #1, Club House Road, Chennai - 600 002, India Telephone: +91-44-40020700, 28460390; Facsimile: +91-44-28460129	Ms. Pushpita Dasgupta, Company Secretary & Compliance Officer Safa Systems & Technologies Limited 46/2631 B, Safa Arcade, Kaniyapilly Road, Chakkaraparambu, Ernakulam-680208, Kerala, India Contact No: 7593001140 Email ID: office@sssinfo.in Website: www.sssinfo.in
Contact Person: Mr. S. Ramakrishna Iyengar Website: www.finshoregroup.com Investor Grievance Email: info@finshoregroup.com SEBI Registration No: INM000012185 CIN No: U74900WB2011PLC169377	Email: investor@cameoindia.com Contact Person: Mr. R.D. Ramasamy, Director Website: www.cameoindia.com SEBI Registration Number: INR000003753 CIN No: U67120TN1998PLC041613	Applicants can contact the Compliance Officer or the LM or the Registrar to the Issue in case of any Pre- Issue or Post- Issue related problems, such as non-receipt of Allotment Advice or credit of allotted Equity Shares in the respective beneficiary account or unblocking of funds etc.

AVAILABILITY OF PROSPECTUS: Investors should note that investment in Equity Shares involves a high degree of risk and investors are advised to refer to the Prospectus and the Risk Factor contained therein, before applying in the Issue. Full copy of the Prospectus shall be available at the website of SEBI at www.sebi.gov.in; the website of Stock Exchange at www.bseindia.com, the website of Lead Manager at www.finshoregroup.com and the website of the Issuer Company at www.sssinfo.in

AVAILABILITY OF APPLICATION FORMS: The Application Forms and copies of the Prospectus may be obtained from the Registered Office of Safa Systems & Technologies Limited, Lead Manager: Finshore Management Services Limited. Application Forms will be available at the selected location of registered brokers, Banker to the Issue, RTA and Depository Participants. Application Forms can also be obtained from the Designated Branches of SCSBs, the list of which is available on the website of SEBI at www.sebi.gov.in. Application Forms can also be downloaded from the website of Stock Exchange at www.bseindia.com.

APPLICATION SUPPORTED BY BLOCKED AMOUNT OR ASBA OR UPI: An application, whether physical or electronic, used by ASBA Bidders, to make a Bid authorizing a SCSB to block the Bid Amount in the ASBA Account including the bank account linked with UPI ID. Pursuant to SEBI Circular No. SEBI/HO/CFD/DCR2/CIR/P/2019/133 dated November 08, 2019, Retail Individual Investors applying in public issue may use either Application Supported by Blocked Amount (ASBA) process or UPI payment mechanism by providing UPI ID in the Application Form which is linked from Bank Account of the investor.

BANKER TO THE ISSUE AND SPONSOR BANK: ICICI Bank Limited.

All capitalized terms used herein and not specifically defined shall have the same meaning as ascribed to them in the Prospectus dated January 18, 2022.

Investors should read the Prospectus carefully, including the Risk Factors on page 17 of the Prospectus before making any investment decision.

For SAFA SYSTEMS & TECHNOLOGIES LIMITED On behalf of the Board of Directors

Faizal Bavaraparambil Abdul Khader

Date : January 21. 2022 Managing Director SAFA SYSTEMS & TECHNOLOGIES LIMITED is proposing, subject to market conditions and other considerations, a public issue of its Equity Shares and has filed the Prospectus with the Registrar of Companies, Ernakulam, Kerala. The Prospectus shall be available on the website of SEBI at www.sebi.gov.in, the website of the Lead Manager at www.finshoregroup.com, the website of the BSE i.e. www.bseindia.com, and website of the Issuer Company at www.sssinfo.in. Investors should note that investment in Equity Shares involves a high degree of risk. For details investors should refer to and rely on the Prospectus including the section titled "*Risk Factors*" beginning on page 17 of the Prospectus, which has been filed with ROC.

The Equity Shares have not been and will not be registered under the US Securities Act (the "Securities Act") or any state securities law in United States and may not be Issued or sold within the United States or to, or for the account or benefit of, "U.S. persons" (as defined in the Regulations under the Securities Act), except pursuant to an exemption from, or in a transaction not subject to the registration requirements of the Securities Act of 1933 CONCEPT

lays from the date of declaration of qualified bidders. 3. The qualified bidders will be later required deposit refundable Earnest Money Deposit ("**EMD**") as detailed in the Process Document whi will be issued to the qualified bidders later. 4. The qualified bidders cannot bid for any value below he reserve price. The qualified bidders can increase their bid amount by a minimum incrementation of the second amount as specified in the specific category or in multiples of said amount. **5.** The qualified bidders efore submitting their bid, should make their independent inquiries / due diligence regarding th encumbrances, the title of a property, claims / rights / dues / affecting the property, inspect the roperty at their expenses and satisfy themselves. **6** The qualified bidders shall be provided with the login ID and Password for the e-auction portal to enable the Bidder to bid for the asset, usiness, only after deposit of EMD and declaration as per the format provided in the Proces ocument which shall be shared with the qualified bidder. 7. Name of the qualified bidders wi e notified by the Liquidator for participation in online e-auction through the e-auction platform rovider which would be disclosed later. The Liquidator will provide User ID and password b nail to the qualified bidders after due verification of KYC of the qualified bidders and submiss of EMD by such qualified bidders. 8. In case bid is placed in the last 5 minutes of the closing tim f the e-auction, the closing time will automatically get extended for 15 minutes with unlimite xtension. 9. The qualified bidder who submits the highest bid amount (not below the reserv nrice) on the closure of the E-auction process shall be declared as Highest Bidder (H1 Bidder and communication to that effect will be issued through electronic mode which shall be subject to pproval by the Liquidator in terms of the provisions of the IBC and the Liquidation Regulation Display the second s djustment against the sale consideration and the EMD of unsuccessful bidders, (excluding H idder), shall be refunded within 30 days from the date of e-auction. The EMD shall not carry any nterest. The H1 Bidder shall have to deposit the balance sale consideration within 90 days from e issuance of Letter of Intent ("LoI") by the Liquidator in terms of the Process Document subje o H1 Bidder being found eligible under Section 29A of the IBC. Provided that payments made afte 30 (Thirty) days from the LoI shall attract interest at the rate of 12% :- a. Default in the accepting and executing the Lol and / or deposit the balance consideration by the H1 Bidder in the mann as stated above shall entail forfeiture of the EMD submitted by it. **b.** In case. H1 Bidder is foun neligible under Section 29A of the IBC or in the event HI Bidder commits default in compl bove conditions, then subject to fulfilling the eligibility under Section 29A of the IBC. H2 Bidde will be declared as Successful Bidder and who shall have to follow the same process as above. rovided further that the sale shall be cancelled if the payment is not received within the maxim eriod of 90 (Ninety) days. 11. The Successful bidder shall bear the applicable stamp duties ansfer charge, fees etc. and all the statutory dues, taxes, rates, assessment charges, fees etc., espect of the purchase of the property through auction, **12.** The Liquidator has the absolute righ to accept or reject any or all offer(s) or adjourn / postpone / cancel the e-auction or withdraw an property or part thereof from the auction proceeding at any stage without assigning any reaso nerefor. 13. The details of assets deemed to be relinquished and non-relinquished assets will b entioned in the Process Document which will be shared with the qualified bidders. Such nor elinquished assets are assets on which the secured financial creditor have not relinquished thei security interest under Section 52 of the IBC. Based on the price discovered for non-relinquisher assets, the Liquidator will negotiate with the concerned secured financial creditors for the elinguishment of such assets under Section 52 of the IBC. In case the secured financial credito bes not consent to relinquish the non-relinquished assets then the same shall not be included a art of the sale. The Liquidator reserves the right to extend the timeline of the e-auction. 14. The sale certificate / agreement will be issued in the name of the Successful Bidder only and will not be issued in any other name. **15.** The Successful Bidder shall run the Corporate Debtor as a going oncern by taking such appropriate measures as may be necessary to meet the objectives of the BC. The Successful Bidder will also be entitled to seek appropriate reliefs and concessions, if any which it may require for continuation of the Corporate Debtor as a going concern from the Hon'ble NCLT. 16. The sale shall be subject to provisions of the IBC and the regulations made thereunder. a Submission of application form along with Participation fees : 27th January 2022; b) Declaration of eligible participant : 29th January 2022; c) The Last date for due diligence (VDR access) ruary 2022; d) Last Date for submission of EMD : 11th February 2022; e) Date of Auctio 15th February 2022 (11:00 a. m. - 2:00 p. m. IST)

The Participants shall submit the required documents in hard copy in a sealed envelope to th bllowing address by post or deliver in person :

Mr. Anil Mehta, Liquidator-Pratibha Industries Limited (In Liquidation) Office No. 1607/1608, 16th Floor, Cyberone Building, Behind Odisha Bhawan, Plot Nos. 4 & 6, Sector-30A, Vashi, Navi Mumbai-400 705.

The Participants shall also be required to submit a soft copy of Eligibility Documents along wi equisite annexures / documents by way of an email at liquidator.pratibha@gmail.com. #The timeline for payment of final sale consideration may be extended at the sole discretion of e Liquidator, to the extent permissible under the applicable laws and regulations. In case the participant is not found to be eligible, the Liquidator shall refund the Participation Fee to the said

If further updates and modifications to this would be notified on the Pratibha Indust .imited website page https://www.pratibhagroup.com/pages/liquidation.htm

Anil Mehta, Liquidator, Pratibha Industries Limited (In Liquidat Address : 1607/1608, 16th Floor, Cyber One, Behind Odisha Bhawar

Sector-30A, Vashi. Navi Mumbai-400 703

Email Id : liquidator.pratibha@gmail.con

Registration Number : IBBI/IPA-001/IP-P00749/2017-2018/11282 Email Id : liquidator.pratibha@gr

Anil Mehta has been granted a certificate of registration to inter alia act as Liquidator by the Insolvency and Bankruptcy Board of India. The affairs, business and property of **Pratibh** Industries Limited are being managed by the Liquidator, Anil Mehta, who acts as an agen of Pratibha Industries Limited only and without personal liability. Mumbai

Date : 21st January 2022



Place : Kerala







NALWA SONS INVESTMENTS LIMITED

CIN: L65993DL1970PLC146414 Regd. Office : 28, Najafgarh Road, Moti Nagar Industrial Area, New Delhi - 110 015 Ph. No.: (011) 45021854, 45021812, Fax : (011) 25928118, 45021982, Email Id.: investorcare@nalwasons.com. Website: www.nalwasons.com Branch Office : O.P. Jindal Marg, Hisar- 125005, Haryana

EXTRACT OF UNAUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2021

(Rs. In lakhs, except per share data									er share data)		
			Standalon	e		Consolidated					
S.	Particulars		er ended	Nine mont	hs ended	Year ended	d Quarter ended		Nine months ended		Year ended
No		31.12.2021	31.12.2020	31.12.2021	31.12.2020	31.03.2021	31.12.2021	31.12.2020	31.12.2021	31.12.2020	31.03.2021
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total income from operations	683.85	473.09	6,445.72	4,202.62	4,608.06	944.38	762.94	8,536.64	6,061.35	6,751.80
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/ or Extraordinary items)	630.92	(36.55)	6,279.34	3,155.44	3,516.43	873.44	258.56	7,281.53	3,985.58	4,608.27
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/ or Extraordinary items)	630.92	(36.55)	6,279.34	3,155.44	3,516.43	872.79	407.01	7,233.04	4,132.59	4,758.86
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/ or Extraordinary items)	652.65	(30.02)	5,125.27	2,749.49	3,320.97	833.86	348.10	5,887.40	3,538.78	4,314.14
5	Total Comprehensive Income for the period [Comprising Profit/Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(83,094.12)	1,06,436.75	2,33,874.21	1,24,264.68	1,87,594.98	(80,957.03)	1,09,183.77	2,42,392.18	1,28,974.71	1,92,064.28
6	Equity Share Capital	513.62	513.62	513.62	513.62	513.62	513.62	513.62	513.62	513.62	513.62
7	Other Equity					5,04,230.43					5,10,050.84
8	Earning Per Share (of Rs. 10/- Each) (for continuing and discontinued operations)										
	1. Basic:	12.71	(0.58)	99.79	53.53	64.66	16.24	6.78	114.63	68.90	84.00
	2. Diluted:	12.71	(0.58)	99.79	53.53	64.66	16.24	6.78	114.63	68.90	84.00

Note: The above results have been reviewed by Audit Committee and approved by the Board of Directors in their respective meetings held on 11th February, 2022 and limited review of the same has been carried out by the statutory auditors

The above is an extract of the detailed format of Quarterly and Nine months ended Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and nine months ended Financial Results are available on the Company's website (www.nalwasons.com) and websites of Stock Exchanges (www.bseindia.com/www.nseindia.com) For Nalwa Sons Investments Limited

Place : Hisar Date: 11th February, 2022

TOTAL

Rakesh Kumar Garg Executive Director & C.E.O DIN:00038580

TOTAL TRANSPORT SYSTEMS LIMITED TRANSPORT eeping Promises Since 1994

Member of the C.P. World Group Registered Office: 7th floor, T Square, Opp. Chandivali Petrol Pump, Saki Vihar Road, Saki Naka, Andheri (E), Mumbai - 400 072. Maharashtra, INDIA.

Tel. No.: +91-22-66441500 | Fax: +91-22-66441585 | Email: info@ttspl.in | Website: www.ttspl.in CIN: L63090MH1995PLC091063

EXTRACT OF UNAUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER **ENDED DECEMBER 31, 2021**

				STAND	ALONE			CONSOLIDATED					
		Q	Quarter Ended on			Nine Months Ended Year Ended		Quarter Ended on			Nine Months Ended		Year Ended
Sr. No.	Particulars	31st December 2021	30th September 2021	31st December 2020	31st December 2021	31st December 2020	31st March 2021	31st December 2021	30th September 2021	31st December 2020	31st December 2021	31st December 2020	31st March 2021
		UNAUDITED				UNAUDITED	AUDITED					UNAUDITED	AUDITED
1	Total Income from Operations	15441.00	12522.73	6646.92	37069.68	17812.95	26497.56	16974.20	13887.14	8193.95	41133.19	21894.58	31513.93
2	Net Profit/(Loss) for the period (before Tax and Exceptional items)	400.27	423.19	67.32	1101.67	-93.76	278.46	372.47	382.36	51.35	1058.74	-217.91	1.86
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional items)	400.27	423.19	67.32	1101.67	-93.76	278.46	370.62	381.60	49.66	1054.28	-220.72	-4.91
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional items)	296.69	267.14	67.32	781.92	-101.29	201.56	270.63	225.42	48.46	738.49	-229.84	-86.31
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	296.69	267.14	67.32	781.92	-101.29	174.13	268.87	225.43	48.46	736.74	-229.71	-113.32
6	Paid up Equity Share Capital (Face Value of ₹ 10/- per Equity Share)	1430.60	1430.60	1430.60	1430.60	1430.60	1430.60	1430.60	1430.60	1430.60	1430.60	1430.60	1,430.60
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	4393.95	3443.91	3719.33	-	-	-	3828.93	3049.82	3,170.13
8	Earnings Per Share (of ₹ 10/- each) (for continuing and discontinued operations) -												
	1 Basic 2 Diluted	2.07 2.07	1.87 1.87	0.47 0.47	5.47 5.47	-0.71 -0.71	1.41 1.41	1.89 1.89	1.58 1.58	0.34 0.34	5.16 5.16	-1.61 -1.61	-0.59 -0.59
Notes	Notes: 1. The above Unaudited results, which have been subjected to Limited Review report by the statutory Auditors of the Company are published in accordance with regulation 33 of the SEBI (LODR Regulations, have been reviewed by the audit committee and approved and taken on record by the Board of Directors at its meeting held through Video Conferencing on 11th February 2022. The financial: results are prepared in accordance with Indian Accounting Standards (Ind AS) as prescribed under Section 133 of the Companies Act, 2013 read with Companies (Indian Accounting Standards) Rules Companies (Indian Accounting Standards) (Amendment) Rules and other accounting standards generally accepted in India.												

2. The above financial results is an extract of the detailed format of the financial results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation 2015 the full format are available on the website of the Company i.e. www.ttspl.in under investor tab and on the website of national stock exchange i.e. www.nseindia.com

For Total Transport Systems Limited

₹ in Lac

FINANCIAL EXPRESS



Extract of Standalone Financial Results for the Nine Months ended 31st December 2021

S. No.	Particulars	Quarter Ended 31/12/2021 (Unaudited)	Quarter Ended 31/12/2020 (Unaudited)	Year Ended 31/03/2021 (Audited)
1	Total Income from operations	92,608.20	84,243.58	3,34,556.29
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(16,165.88)	22,026.96	31,542.57
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(16,165.88)	22,026.96	31,542.57
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(17,806.63)	9,367.58	28,527.43
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(17,837.50)	9,292.70	28,576.37
6	Paid up Equity Share Capital	9,99,991.62	9,99,991.62	9,99,991.62
7	Reserves (excluding Revaluation Reserves)	1,72,655.25	62,060.80	65,455.45
8	Securities Premium Account	235.50	235.50	235.50
9	Outstanding Debt	38,00,189.53	33,35,125.70	39,70,063.2
10	Net Worth	11,72,646.88	10,62,052.43	10,65,447.0
11	Debt Equity Ratio	3.24	3.14	3.7
12	Weighted Average Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -			
	1. Basic (Rs.) :	(0.18)*	0.09*	0.29
	2. Diluted (Rs.) :	(0.18)*	0.09*	0.29

Note:

Dated: 11.02.2022 Place: New Delhi

- a) The above is an extract of the detailed format of Nine Months/annual financial results filed with the Stock Exchanges under Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Nine Months/annual financial results are available on www.bseindia.com. www.nseindia.com and on www.iifcl.in.
- b) For the items referred in sub-clauses (a), (b), (d) and (e) of the Regulation 52 (4) of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures have been made to the Stock Exchange (BSE and NSE) and can be accessed on www.bseindia.com and www.nseindia.com.
- c) The above results have been reviewed by the Audit Committee at their Meeting held on 11th February 2022 and approved by the Board of Directors of the company at their Meeting held on 11th February 2022. The results for the nine months ended 31st December 2021 are reviewed by the Statutory Auditors of IIFCL

For and behalf of Board of Directors Sd/-PR Jaishankar

(Managing Director) DIN No.: 6711526



Place : Mumba

Dated : 11th February, 2022

Managing Director DIN : 00102413

Makarand Pradhan

Sd/-

APM TERMINALS Lifting Global Trade.

GUJARAT PIPAVAV PORT LIMITED

Registered Office : Pipavav Port, At Post Rampara-2, Tal. Rajula, Dist. Amreli, Gujarat 365560. CIN: L63010GJ1992PLC018106 Tel: 02794 242400 Fax: 02794 242413 Website: www.pipavav.com Email: investorrelationinppv@apmterminals.com

STATEMENT OF STANDALONE UNAUDITED RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31 DECEMBER 2021

					(Amt in	Rs Million)		
Particulars	STANDALONE							
	3 months	Preceding	Corresponding 3	Year to date	Year to date figure			
	ended	3 months ended	the previous year	figure for current period ended on	for previous period ended on	ended		
	31/12/2021	30/09/2021	31/12/2020	31/12/2021	31/12/2020	31/03/2021		
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)		
Total Income from Operations (Net)	1,685.61	1,946.98	1,984.00	5,228.78	5,400.36	7,334.63		
Net Profit/(Loss) from Ordinary activities after Tax								
(after extraordinary items)	437.64	452.76	543.27	1,212.03	1,527.02	2,180.77		
Paid-up equity share capital (Face value Rs. 10 per share)	4,834.40	4,834.40	4,834.40	4,834.40	4,834.40	4,834.40		
Other Equity as per the Balance Sheet of previous								
accounting year						15,487.59		
Earnings per share (Before and after extraordinary items)								
(of Rs. 10 each) (not annualized)								
Basic:	0.91	0.94	1.12	2.51	3.17	4.52		
Diluted:	0.91	0.94	1.12	2.51	3.17	4.52		

STATEMENT OF CONSOLIDATED UNAUDITED RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31 DECEMBER 2021 (Amt in Re Millie

	-				(Amt In	RS MIIIION)			
Particulars	CONSOLIDATED								
	3 months ended	Preceding 3 months ended	Corresponding 3 months ended in the previous year	0	Year to date figure for previous period sended on	ended			
	31/12/2021	30/09/2021	31/12/2020	31/12/2021	31/12/2020	31/03/2021			
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)			
Total Income from Operations (Net)	1,685.61	1,946.98	1,984.00	5,228.78	5,400.36	7,334.63			
Net Profit/(Loss) from Ordinary activities after Tax									
(after extraordinary items)	446.00	452.31	587.50	1,225.96	1,561.06	2,216.45			
Paid-up equity share capital (Face value Rs. 10 per share)	4,834.40	4,834.40	4,834.40	4,834.40	4,834.40	4,834.40			
Other Equity as per the Balance Sheet of previous									
accounting year						17,557.38			
Earnings per share (Before and after extraordinary items)									
(of Rs. 10 each) (not annualized)									
Basic:	0.92	0.94	1.21	2.54	3.24	4.59			
Diluted:	0.92	0.94	1.21	2.54	3.24	4.59			

Note: The above is an extract of detailed format of Quarter end Financial results filed with Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarter end financial results is available on the stock exchange websites (www.besindia.com and www.nseindia.com) and on the company's website, www.pipavav.com

Place: Mumbai Date : 10th February 2022 For Gujarat Pipavav Port Limited

Jakob Friis Sorensen Managing Director

Profit / (Loss) for the period (after tax) and Other 1,857.30 1,337.56 6,524.61 Comprehensive Income (after tax)] Paid up Equity Share Capital 21,687.93 20,039.43 20,250.05 6 Reserves (excluding Revaluation Reserve) 31,805.94 7 41.605.85 29.181.30 Securities Premium Account 7,068.66 2,291.65 2,755.03 8 9 Net worth (Excl. Revaluation Reserve) 63,293.78 49,220.73 52,055.99 Paid up Debt Capital / Outstanding Debt 3,93,029.79 10 3,26,112.28 3,45,571.39 11 Outstanding Redeemable Preference Shares Nil Nil Nil 12 Debt Equity Ratio 6.63 6.21 6.64 Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations)-13 1. Basic 0.89 0.68 3.31 2. Diluted 0.89 0.64 3.12 14 Capital Redemption Reserve Nil Nil Nil 15 Debenture Redemption Reserve 16 Debt Service Coverage Ratio Not Applicable 17 Interest Service Ratio Not Applicable Disclosure in Compliance with Regulation 52(4) of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 for the period ended December 31, 2021 Ratio/Amount **Particulars** No 1 Debt-equity ratio 6.21 Not Applicable Debt service coverage ratio 2 3 Interest service coverage ratio Not Applicable 4 Outstanding redeemable preference shares (quantity and value) Not Applicable Capital redemption reserve/debenture redemption reserve Not Applicable 5 6 Net worth (Excl. Revaluation Reserve) ₹ 63.293.78 Lakhs 7 Net profit after tax ₹ 5,521.42 Lakhs Earnings per share 8 Basic 2.64 Diluted 2.64 9 Current Ratio 2.35 10 Long Term Debt to Working Capital 0.81 11 Bad debts to Account receivable ratio Not Applicable 12 Current liability Ratio 0.46 13 Total debts to total assets 0.85 Not Applicable Debtors turnover 14 Inventory turnover 15 Not Applicable 16 Operating margin (%) Not Applicable 17 Net profit margin (%) 12.02% Sector specific equivalent ratios, as applicable a) Gross NPA 1.75% 18 b) Net NPA 1.09% c) CRAR 20.09%

Notes

i. The above is an extract of the detailed format of quarterly financial results filed with the Stock Exchanges under Regulation 52 of the LODR Regulations. The full format of the quarterly financial results is available on the websites of the Bombay Stock Exchange (www.bseindia.com) and the listed entity (www.kosamattam.com)

ii. For the other line items referred in regulation 52 (4) of the LODR Regulations, pertinent disclosures have been made to the Bombay Stock Exchange on the URL www.bseindia.com and can be accessed on the URL www.kosamattam.com.

For Kosamattam Finance Limited

Place: Kottayam Date: 11-02-2022

Sd/-Mathew K. Cherian Managing Director DIN:01286073









ч

કંપની સેક્રેટરી અને કમ્પ્લાયન્સ ઓફિસર



કરવામાં આવી.

કલેકટર દ્વારા પ્લોટની ફાળવણી કરવામાં અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે આ જમીન ઉપર માત્ર રહેશાંક આવી હોવાથી તેનો ઓર્ડર આપી

૧ પદિવસમાં જિલ્લા કલેકટરને રિપોર્ટ

કરવાનો રહેશે.

<u>દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેરી શ્રધ્ધા સાથે શ્રી શ્યામ યૂવક મંડળ દ્વારા</u> અમરેલીમાં શ્રી શામજીબાપૂની ઉલ્યાઇ

શ્યામવાડી ખાતે પુજ્ય શામજીબાપુની અમરેલી કડીચા સમાજના પ્રમુખ શ્રી ભરતભાઇટાંક, હરજીવનભાઇટાંક, ઉર્વીબેન કડીચા સમાજનાં લોકોએ દર્શન અને પુજા આરતી અને ગૌશાળામાં ગૌપુજા ટાંક સહિત ટ્રસ્ટીઓની ખાસ ઉપસ્થિતીમાં કોરોના ગાઇડલાઇન મુજબ આચોજન પુજન, અર્ચન કરી ધન્યતા અનુભવી



સભ્યશ્રી અશોકભાઈ પોપટભાઈ મકવાણ ગેડીયા, કારોબારી સભ્યશ્રી બાબુભાઈ અશ્વિનભાઈ નાથાભાઈ વાઢેર, કારોબારી કારોબારી સભ્યશ્રી સહુ એ હાજર રહી <u>એક યાદીમાં જણાવયૂ છે</u>



સ્થળ :- પાંજરાપોળ ગૌશાળા - અમરેલી

પાણી દરવાજા રોડ, જીવદચા ભવન, અમરેલી સંપર્ક : મો.હલ્ટ૪૫ ૩૪૫૨૨ - ૯૪૯૯૮ ૮૩૩૦૪

યાકબ ફ્રિસ સોરેન્સેન

મેનેજિંગ ડાયરેક્ટર

ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ

રજીસ્ટર્ડ ઓફિસઃ પિપાવાવ પોર્ટું મુકામ પોસ્ટ રામપરમ2, તાલુકો રાજુલા જિલ્લો અમરેલી365560 CIN: L63010GJ1992PLC018106 ટેલીફીન: 02794 242400 ફેક્સ: 02794 242413

વેબસાઇટ: www.pipavav.comઇમેલ: investorrelationinppv@ap mterminals.com

	31 ડિસેમ્બર, 2021ના રોજ	પૂર્ણ થયેલા ત્રણ મહિના અને	તે નવ મહિના માટે સ્વતંત્ર ધોર	રણે ઓડિટ ન થયેલા પરિણામો		(૨કમ રૂ. મિલિયનમા)
વિગત	3 મહિનાના અંતે	અગાઉના 3 મહિના માટે	ગયા વર્ષના સમાન3 મહિના માટે	વર્ષમાં અત્યાર સુધી પૂર્ણ થયેલા નવ મહિના માટે	અગાઉના વર્ષનાં પ્રથમ નવ મહિના માટે	પૂર્ણ થયેલા વર્ષ માટે
	31/12/2021	30/09/2021	31/12/2020	31/12/2021	31/12/2020	31/03/2021
	(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(ઓડિટેડ)
કામગીરીમાંથી કુલ આવક (ચોખ્ખી)	1,685.61	1,946.98	1,984.00	5,228.78	5,400.36	7,334.63
કરવેરાની ચુકવણી પછી સાધારણ કામગીરીમાંથી ચોખ્ખો નફો/(નુકસાન) (અસાધારણ ખર્ચ પછી)	437.64	452.76	543.27	1,212.03	1,527.02	2,180.77
પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડી (શેરદીઠ રૂ. 10ની ફેસ વેલ્યુ)	4,834.40	4,834.40	4,834.40	4,834.40	4,834.40	4,834.40
અગાઉના એકાઉન્ટિંગ વર્ષની બેલેન્સ શીટ મુજબ અન્ય ઇક્વિટી						15,487.59
શેરદીઠ આવક (અસાધારણ ખર્ચ અગાઉ અને પછી) (દરેકના રૂ. 10) (વાર્ષિક નહીં)						
મૂળભૂત:	0.91	0.94	1.12	2.51	3.17	4.52
ડાઇલ્યુટેડ:	0.91	0.94	1.12	2.51	3.17	4.52
	31 ใญ้มณะ 2021-เป	રોજ પર્ધ થયેલા ત્રણ પ્રહિતા	અને નવ પ્રહિના પાટે ઓરિટ	ล หมิดเ ฉ่มผล บุโวตเมโ		

તર, 2021ના રોજ પૂર્ણ થયેલા ત્રણ મહિના

						(રકમ રૂ મિલિયનમા)
વિગત	3 મહિનાના અંતે	અગાઉના 3 મહિના માટે	ગયા વર્ષના સમાન3 મહિના માટે	વર્ષમાં અત્યાર સુધી પૂર્ણ થયેલા નવ મહિના માટે	અગાઉના વર્ષનાં પ્રથમ નવ મહિના માટે	પૂર્ણ થયેલા વર્ષ માટે
	31/12/2021	30/09/2021	31/12/2020	31/12/2021	31/12/2020	31/03/2021
	(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(ઓડિટેડ)
કામગીરીમાંથી કુલ આવક (ચોખ્ખી)	1,685.61	1,946.98	1,984.00	5,228.78	5,400.36	7,334.63
કરવેરાની ચુકવણી પછી સાધારણ કામગીરીમાંથી ચોખ્ખો નફો/(નુકસાન) (અસાધારણ ખર્ચ પછી)	446.00	452.31	587.50	1,225.96	1,561.06	2,216.45
પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડી (શેરદીઠ રૂ. 10ની ફેસ વેલ્યુ)	4,834.40	4,834.40	4,834.40	4,834.40	4,834.40	4,834.40
અગાઉના એકાઉન્ટિંગ વર્ષની બેલેન્સ શીટ મુજબ અન્ય ઇક્વિટી						17,557.38
શેરદીઠ આવક (અસાધારણ ખર્ચ અગાઉ અને પછી) (દરેકના રૂ. 10) (વાર્ષિક નહી)						
મૂળભૂત:	0.92	0.94	1.21	2.54	3.24	4.59
ડાઇલ્યુટેડ:	0.92	0.94	1.21	2.54	3.24	4.59

નોંધ: ઉપરોક્ત વિગત સેબી (લિસ્ટિંગ જવાબદારીઓ અને જાહેર કરવાની જરૂરિયાતો) નિયમન, 2015ના નિયમન 33 અંતર્ગત સ્ટોક એક્સચેન્જમાં ફાઇલ કરવામાં આવેલા ત્રિમાસિક ગાળાના અંતના નાણાકીય પરિણામોનો સાર છે . ત્રિમાસિક ગાળાને અંતનાં નાણાકી પરિણામોની સંપૂર્ણ ફોર્મેટ સ્ટોક એક્સચેન્જની વેબસાઇટો (<u>www.besindia.com</u>અન<u>ેwww.nseindia.com</u>) અને કંપનીની વેબસાઇટ<mark>www.pipavav.com</mark>પર ઉપલબ્ધ છે ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ માટે

ધર્મિષ્ઠા ટાંક તેમજ મહિલા મંડળ ના વૈશાલીબેન તેમજમહિલામંડળના હોદેદારો શ્યામ યુવક મંડળ દ્વારા તેમજ ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ દ્વારા નવ નિયુક્ત સભ્યો નું શામજી બાપુ ની ૩૯ મી તિથી ની કોરોના ગાઈડ લાઈન સાથે અમરેલી લીલીયા રોડ હાજરી માં ગૌ પૂજા અને શામજી બાપુની પૂજા કરવામાં આવી હતી જયેશભાઇ ટાંકની જિલ્લા ભાજપના મંત્રી તરીકે નિમણૂંક થતા કડીયા આપ લખા છે. પ્રાપ્ત પ્રચાર પ્રાપ્ત પ્રાપ્ત પ્રાપ્ત છે. ભવ્યે સપ્તા કરવામાં આવ્યું હતું આતકે નવોદય વિદ્યાલય ના પોરિયા સાહેબ ઈ ઓફિસરઈન્દ્રજીત ટાંક સાહેબ નું પણ હરજીવન ભાઈ ટાંક મનસુખભાઇ તેમજ ભારતભાઈ દારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી કાર્યક્રમાં શ્યામ વાડી ખાતે ગઈકાલે સવારે સાદાઈ થી સમાજપ્રુમુખભરતભાઈ એશાલઓઢાડીપુષ્પ ગુચ્છ આપી તેમનું સન્માન કર્યું હતું તેમજ. પત્રકાર હરેશ ટાંક. ની જિલ્લા ભાજપના શામજી બાપુની પૂજા આરતી તેમજ ગૌશાળા માં ગૌ પૂજા અમરેલી કડિયા સમાજના ભરત ભાઈ ટાંક ઉપ પ્રુમુખ અને ટ્રસ્ટી હરજીવનભાઈ ટાંકતેમજ મહિલા મંડળ બક્ષીપંચ મોરચાના મીડિયા કન્વીનર તેમજ પુમુખઉર્વીબેનટાંકતેમજસમાજના ટ્રસ્ટીઓ ૨વજીભાઈકાચા. ૨મણિકભાઈ . ગળા વર્ષ નારવા ગામાં માંડવા કે વા પર તેમ ક સાવરકુંડલા ના પ્રભારી તરીકે નિયુક્તિ થતાં બોલતા હરજીવનભાઈ ટાંક (ઉપપ્રમુખ કડીયા સમાજ અમરેલી) એજણાવ્યું હતું કે તેઓ નું કડીયા સમાજ ના ઉપપ્રમુખ હરજીવનભાઈટાંકેશાલઓઢાડીપુષ્યગુચ્છ આપી સન્માન કર્યું હતુ તેમજ ભાવેશભાઈ પરમાર ની શિક્ષણ સમિતિમાં નિયુક્તિ થતા કોશીકભાઈ ટાંક ટાંક.મનસુખભાઇ ચૌહાન .જિહ્વા ભાજપ ના મંત્રી જયેશભાઇ ટાંક શ્યામયુવક મંડલનાપ્રમુખ વિજયભાઈ માટુ ભાજપ માં નિયુક્ત થયેલા બક્ષીપંચ મોરચા ના હોદેદારો આપણી જ્ઞાતી ને દેશ લેવલે ઓબીસી સમાજ ના લિસ્ટ માં વેલી તકે નામ ઉપપ્રમુખહરેશભાઈ એચ.ટાંકહિતેશભાઈ મનાણી તેમજ સમાજના આગેવાનો અને મહિલા મંડળ ઉપપ્રમુખ ત્રીવેણીબેન જેઠવા તેમજ.કિશોરભાઇ આજગિયા ની અમરેલી દાખલ થાઈ તેવા પ્રયાસો કરવા વિનંતી કરી શહેરબશીપંચમોરચાના શહેર પ્રુમુખ તરીકે નિયુક્તિ થતાં. તેમજ સુરેશભાઈ સોલંકી હતી અને નવનિયુકત હોદેદારો ને આવકાર્યા હતા જયારે મહિલા મંડળ ના પ્રમુખ ઉર્વીબેન ટાંકે પણ સહુને આવકાર્યા હતા અને સત્સંગ પત્રકાર અને મહિલા મંડળ માજી ઉપપ્રમુખ આંતરરાષ્ટીય. વિશ્વ હિંદ પરિષદમાં.અને

મા મહિલા મંડળ ને સંબોધન કર્યું હતું જ્યારે

રવજીભાઈ કાચા એ પ્રાસંગિક પ્રવચન કરી

આપી જણાવીએ છીએ.

ą

સ્થળ: મુંબઈ

તારીખ: 10ફેબ્રુઆરી 2022

-:: જાહેર નોટીસ ::-

જજ સાઢેબની કોર્ટમાં જમાં હોચ જેમાં ઉપરોક્ત તમામ ઘસમોર પેસા ઉપાડવા અરજ કરેલ હોચ તો જે કોઇપણ વ્યક્તિને વાંધ

તકરાર હોચ તો તા.૧૪-૨-૨૦૨૨ ના રોજ નામદાર રાજુલા સિવીલ

૪૪ સી.ડી. સાહેબની કોર્ટમાં વાંધા રજુ કરવા આ જાહેર નોટીર

કલોથ સ્ટોર એક જ ભાવ હરી રોડ, અમરેલી ાક્ષીને કાપડની કવોલીટી બનતી હો ાણ જાતની ગેરંટી આપવામાં આવતી સંકુલ ધો[.] ૧૧–૧૨ આર્ટસ કોમર્સ સાચંસ ગુજરાતી મીડીચમ – ઇંગ્લીશ મીડીચમ વ્યવસ્થા ધો. ૧૧–૧૨ આર્ટસ – સાયકોલોજી – સોસીયોલોજી –

હંમેશ<u>ા કંઇક</u> નવું

– ઈકોનોમિક્સ વિષય વ્યવસ્થા

સાયંસ A & B ગૃપ • કોમર્સ – A/c - સ્ટેટ. - BA - SPCC - Comp ૧ લી માર્ચ ૨૦૨૨ થી પ્રોવિઝનલ નવા પ્રવેશ શરૂ થશે એક સત્રની સ્કૂલ ફી અને એક સત્રનું હોસ્ટેલ લવાજમ ભરવું

શ્રી અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેઠાલ ટ્રસ્ટ સુરત-સંસ્થાપિત * શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ, ચક્કરગઢ રોડ, અમરેલી * ફોન::૦૨૭૯૨-૨૩૨૩૧૧ થી ૨૪ - Ad 167

-ઃઃ જાહેર નોટીસ ઃઃ-

આથી સર્વે લાગતા વળગતાને જાશ કરવામાં આવે છે કે, મોજે હિંડોરણા, તા.રાજુલા, જી.અમરેલી મુકામે બિનખેતી જમીન સર્વે નંબર -૧૧૯, માં વાણીજ્ય હેતુ માટેનો પ્લોટ નંબર -૪, ચોરસ મીટર -૩૨૫.૩૨ તથા તેમાં આવેલ મીલ્કત, તે પ્લોટ ઉતરોતર માલીકી હક્કે ફેરફાર થતા હાલ (૧) શાહ દિપેનકુમાર દિપકભાઇ (૨) શાહ વિશાલકુમાર દિપકભાઇ, રે (૧) પાંચ વિચાયુતા માલીકો છે (૧) પાંચ વિચાયુતા દારક પાંચાળા, દ હિલા વાળાની ચુંહત માલીકો છે (૧૦) પાંચ વચ્ચુ રેકર્ડ ગામનો નમુનો નં.૨ માં તેઓનાં નામે ટ્રાન્સફર થયેલ છે, અને તેઓએ સદરહુ ઉપરોક્ત જણાવેલ મીલ્કતનું બેંક લોન લેવાના હેતુસર ટાઇટલ કલીચર સર્ટીફીકેટ મળવા મા પાસે માંગણી કરેલ છે. સદરહુ પ્લોટનાં ઉતરોતર વેચાણ દસ્તાવેજ તપાસતા, સો

જગદીશભાઇ પરમાર રે. રાજુલા એ, સદરહુ પ્લોટ નં ૪, (૧) વાલજીભા નાનજીભાઇ ખોખરીચા (૨) જાદવભાઇ લક્ષ્મણભાઇ પટોળીચા (૩) સુરેશભા મનસુખભાઇ લહેરીનાં કુલમુખત્થાર જચસુખભાઇ વલ્લભભાઇ કાકડીચા પાસેથ રશું. વૈચાણ દસ્તાવેષ્ અનું નં.૯૯૫, તાં.૦૬-૧૦-૨૦૦૩, ધી વેચાણ રાખેલ છે, અને તેઓની તરફેણમાં કરેલ મુખલાસ્નામુ નોટરી પહલીક શ્રી ડી.એચ. મુણળા, ધારી રૂબરૂ તા.૨૯-૦૯-૨૦૦૩ ના રોષ્ટ્ર નોટરી સીરીચલ નં.૮૩૫/૦૩ નું કરી આપેલ છે, અને તે નોટરી મુખલાસ્નામાની રૂથએ જરાયુખભાછ ાઇ કાકડીયાએ સબ રજીસ્ટ્રાર કચેરી રાજુલામાં રજી. દસ્તાવેલ આપેલ છે

સદરહુ ઉપર જણાવેલ રજી. વેચાણ દસ્તાવેજ અનુ.નં.૯૯૫, તા.૦૬ ાં હતા, અને ૨દ કરવામાં આવેલ ન હતા, જેથી સદરહું મુખત્થ . નાં અધિકાર બાબતે કોઇને કોઇપણ જાતનો વાંધો તકરાર હોય, તેમજ ઉપરોક્ત દસ્તાવે ચા પહેલા, આ ઉપર જણાવેલ મુખત્યારનામુ આપનાર આવેલ હોચ તો અથવા સદરહુ મીલ્કત પરત્વે જો કોઇન પ્રકારનો લાગભાગ, હક્ક, હિત કે હિસ્સો કે વારસાઇ હક્ક કે બેંકન પ્રગારળા લાગભાગ, ૯૩૩, ૧૯૫૩ મહત્ત્વા ૩ પાતદાઇ ૯૩૩ ૭ પડળ બોજો, લીચન હોચ તો, આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિવસ -૭ (સાત) મ નીચે જણાવેલ સરનામે અમોને લેખીત અથવા દસ્તાવેજ આધાર પુરાવા થાં. જાણ કરવી. જો સમય મર્યાદામાં કોઇનો વાંધો તકરાર નહી આવે તો ઉપરોક્ત ક્કતમાં કોઇનો કાંઇપણ પ્રકારનો લાગભાગ કે હક્ક, હિત, હિસ્સો બોજો કે યન નથી, અને હોય તો તે જતા (WAIVE) કરેલ છે. તેમ સમજી અમં સદરહુ મીલ્કતનું ટાઇટલ કલીચર સર્ટીફીકેટ આપીશું. જેની તમામે નોંધ લેવી. સ્થળ : રાજુલા ારીખ : ૧૧-૨-૨૦૨૨

> (દિનેશ આર. નિર્મલ) (જતીન એ. પરમાર) એડવોકેટ એન્ડ નોટરી પબ્લિક એડવોકેટ એસ.ટી. સ્ટેશન પાસે,રાજુલા સીટી